

નમાઝે ગોફેલા પ્રથમ શબે જુમ્આથી શરૂ કરવી અને પછી દરરોજ મગરીબ અને ઈશાના વચમા સુન્નતની નીચ્ચતથી પડવામા ઘણોજ સવાબ છે.

પહેલી રકાતમાં અલ હમદ ના સુરા પછી આ આયત એક વખત પડે :

વ ઝન્નુની ઈઝઝહબ મુગાઝીબન ફઝ્ન અન્નન નકદીરા અલયહી ફનાદા ફી-
ઝુલુમાતી અન લાઈલાહા ઈલ્લા અન્ત સુબહાનક ઈન્ની કુન્તુ
મીનઝઝાલીમીન. ફસ્તજબ્ના લહુ વ નજ્જયનાહુ મીનલ ગમ્મી વ કઝાલીક
નુન્જીલ મોઅમીનીન.

બીજી રકાતમાં, અલ હમદના સુરા પછી એક વખત આ આયત પડે : વ
ઈન્દહુ મફાતીહુલ ગયબી લા યઅલમુહા ઈલ્લાહુવા વ યઅલમુ મા ફીલ બરરી
વલ બહરી વમા તસ્કુતુ મીન વરકતીન ઈલ્લા યઅલમુહા વલા હબ્બતીન ફી
ઝુલુમાતીલ અરઝી વલા રતબીન વલા યાબીસીન ઈલ્લા ફી કીતાબીમ મુબીન.

તેમજ બીજી રકાતમાં કુન્નુતમાં હાથ ઊપાડીને આ દુઆ પડે :

અલ્લાહુમ્મા ઈન્ની અસ્અલુકા બીફાતીહીલ ગયબીલ લતી લા યઅલમુહા ઈલ્લા
અન્તા અન્તુ સદ્દી અલા મુહમ્મદીન વ આલીહી વ અન તફ અલ્બી મા
અન્ત અઅલહુ. અલ્લાહુમ્મા અન્ત વલીયુ નીઅમતી વલ કાદીરુ તલીબતી
તઅલમુ હાજતી ફ અસ્અલુકા બીહકકી મુહમ્મદીન વ આલીહી અલયહીમુસ
સલામ

લીમા કઝયતહાલી યા અરહમર રાહીમીન.

(નમાઝ પુરી થયા બાદ પોતાની હાજાત તલબ કરવી, ઈન્શાઅલ્લાહ પુરી થશે)